

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April -2020
CORPOTATE TAX PLANING -2(DSE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-1 (અ) આવકવેરા ધારા હેઠળ “વિસર્જન સમયે મિલકતોનું વિતરણ” અંગેની સમજૂતી આપો. (10)
 (બ) કર્મચારીઓના મહેનતાણાનાં સંદર્ભમાં 32 આયોજન અને આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (10)

અથવા

- પ્રશ્ન-1 (અ) આવકવેરા ધારા હેઠળ “કર્મચારીઓના મહેનતાણા” અંગેની સમજૂતી આપો.
 (બ) “મિલકતોનું વિસર્જન સમયે વિતરણના” સંદર્ભમાં કર આયોજન અને આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો.
 પ્રશ્ન-2 (અ) આવકવેરા ધારા અન્વયે “વીમા અંગેના વળતરની આવક” અંગેની સમજૂતી આપો. (10)
 (બ) વૈજ્ઞાનિક સંશોધનના સંદર્ભમાં કર આયોજન તથા આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (10)

અથવા

- પ્રશ્ન-2 (અ) આવકવેરા ધારા હેઠળ “વૈજ્ઞાનિક સંશોધન” અંગેની સમજૂતી વિગતવાર આપો.
 (બ) વીમા અંગેની વળતરની પ્રાપ્ત આવકના સંદર્ભમાં કર આયોજન તથા આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો.
 પ્રશ્ન-3 વિગતવાર/સવિસ્તાર નોંધ લખો. (15)
 (અ) બિનરહીશ સંબંધિત વિશિષ્ટ જોગવાઈઓનો પરિચય.
 (બ) ઉચ્ચતર કક્ષાની કિંમત નીતિની કબૂલાત.

અથવા

- પ્રશ્ન-3 ટૂંકનોંધ લખો. (કોઇપણ બે)
 (1) બેવડા કરવેરામાં રાહત.
 (2) ઉચ્ચતર કક્ષાના ચુકાદાઓ.
 (3) ફેરબદલી કિંમત નિર્ધારણ.
 (4) ફેરબદલી કિંમતના નિયમન અંગેની જોગવાઈઓ.
 પ્રશ્ન-4 સવિતાર નોંધ લખો. (15)
 (અ) શાસક અને ગૌણ કંપનીઓ વચ્ચે મિલકતોની ફેરબદલી.
 (બ) વિલીનીકરણ છૂટું કરવું (Demerger) અંગે કરવેરાનું આયોજન.
 (ક) કંપનીનું મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી (LPP)માં રૂપાંતર અંગે.

અથવા

- પ્રશ્ન-4 ટૂંકનોંધ લખો.
 (1) સંપૂર્ણ એકાંકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢીના ધંધાનું કંપનીમાં રૂપાંતર.
 (2) સંયોજનના સંદર્ભમાં કરવેરાનું આયોજન.
 (3) કંપનીના ચાલુ ધંધાનું સંપૂર્ણ કે અંશતઃ જ તે સ્થિતિમાં વેચાણ કરવાની અસરો.

ENGLISH VERSION

Que-1 (A) Give explanation of “Distribution of Assets at the time of Liquidation” under the Income-Tax Act. (10)

(B) Give explanation with examples with reference to “Employee’s Remuneration” Tax Planning and Computation of Income-Tax. (10)

OR

Que-1 (A) Give explanation of “Employee’s Remuneration” under the Income-Tax Act.

(B) Give explanation with examples with reference to “Distribution of Assets at the time of Liquidation” Tax Planning and Computation of Tax.

Que-2 (A) Give explanation of “Receipt of Insurance Compensation” under the Income Tax Law. (10)

(B) Give explanation with examples with reference to “Scientific Research” Tax Planning and Computation of Tax. (10)

OR

Que-2 (A) Give explanation of “Scientific Research” under the Income-Tax Act.

(B) Give explanation with examples with reference to “Receipt of Insurance Compensation” Tax Planning and Computation of Income-Tax.

Que-3 Write details notes on. (15)

(A) Introduction of Special Provisions relating to Non-Residents.

(B) Advance Pricing Policy Agreement.

OR

Que-3 Write short notes on. (Any two)

(1) Double Taxation Relief.

(2) Advance Level Rulings.

(3) Transfer Pricing.

(4) Provisions regulating Transfer Pricing.

Que-4 Write details notes on. (15)

(A) Transfer of Assets between Holding and Subsidiary Companies.

(B) Tax Planning with reference to Demerger.

(C) Conversion of Company in to Limited Liabilities Partnership (L.P.P.)

OR

Que-4 Write short notes on.

(1) Conversion of Sole Proprietary Concern/Partnership firm in to Company

(2) Tax Planning with reference to Demerger.

(3) Effects of Slump Sale.
